



શિક્ષણમાં પ્રત્યાયન પ્રક્રિયા

Communication in Education

Dr. Meena N. Pandya,

Librarian,

H.N.S.B. (BBA) college of Management Studies,
Himatnagar, Gujarat (India)

અંગ્રેજી Communication શબ્દ લેટિન ભાષા Communicare પરથી ઉત્પત્ત થયો. જેનો અર્થ To talk together confer discourse & consult one with another. આમ પ્રત્યાયન શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ Communis થી માનવામાં આવે છે.

વ્યાખ્યાઓ

કીથ ડેવિસ : Keith Davis : “પ્રત્યાયન એક વ્યક્તિનું દ્વારા બીજા વ્યક્તિને સુચના તથા જ્ઞાન આદાન-પ્રદાન કરવાની પ્રક્રિયા.”

ડॅल्टन ई. मेकफॉर्लैंड : Dalton E. McFarland : “तेमના મતે પ્રત્યાયનાને વિશેષરૂપથી એ રીતે પારિમાણિત કરી શકાય કે માનવોની વચ્ચે સાર્થક પારસ્પરિક શાંખદક પ્રક્રિયા સમજાય છે.”

ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરી : “પ્રત્યાયન એ બોલવાની, લખવાની અથવા પ્રતીકો કે સંકેતો દ્વારા વિચારો અથવા જ્ઞાનને બતાવવાની, વ્યક્ત કરવાની અથવા આદાન-પ્રદાન કરવાની પદ્ધતિયા છે.”

“પ્રત્યાયન એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિનો કે સંસ્થાઓ વચ્ચે માહિતીની આપણે અને તેના કાળ સ્વરૂપે સમજ અને પરિષામ પ્રાપ્ત અટલે પ્રત્યાયન પ્રક્રિયા.”

प्रत्यायनना सिद्धांतो

પ્રત્યાયનના સિદ્ધાંતો નીચે મજૂબ દર્શાવી શકાય :

१. संस्पष्टता:

જે સંદર્ભો મોકલવાનો હોય તેના વિચારો અને ભાષામાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. આ સંદેશાઓની જ્યારે અભિવ્યક્તિ કરવામાં આવે ત્યારે તેમાં પણ સંપૂર્ણ સ્પષ્ટતા લાવવી જરૂરી છે, તો જ પ્રત્યાયન અસરકારક થઈ શકે. ચોખ્ખવટ દાખવવી જોઈએ. જો સંક્ષિપ્તમાં હોવા છતાંય સુસ્પષ્ટ હોવું જોઈએ.

੨. ਪਰਿਪੁਣੀਤਾ :

પ્રત્યાયન પરિપૂર્ણ હોવું જોઈએ. પ્રત્યાયનની પ્રક્રિયામાં વ્યક્ત કરેલ વિચાર કે બાબત સર્વે રીતે પૂર્ણ હોવી જોઈએ. વિચારો કમિક, સોપાનબદ્ધ અને અસંદિગ્ય હોય તો તે પ્રત્યાયન પૂર્ણ બને છે. પ્રસંગ બને છે. પરિપૂર્ણતાને કારણે પ્રસ્તિકરણ પ્રશાસ્ય બને છે.

३. स्वीकार :

પ્રત્યાયનમાં વાચક કે શ્રોતાઓનો સ્વીકાર કરવામાં ન આવે તો તે પ્રત્યાયન અધૂરુ અને અપૂર્ણ બને છે. શિક્ષક વિદ્યાર્થીઓના અસ્તિત્વનો સ્વીકાર કરવો જરૂરી છે. જો શિક્ષક વિદ્યાર્થીઓના અસ્તિત્વને જ ન સ્વીકારે તો તેનું પ્રત્યાયન પૂર્વગ્રહયુક્ત બને છે. પ્રત્યાયનમાં વાચક કે શ્રોતાઓનો સ્વીકાર નીચેની બાબતો બર આવવાથી તેની મપ્તુની થાય છે.

- આપ, તમે જેવા માનવાચક શબ્દોનો ઉપયોગ.
 - જાતિગત ભિન્નતાનો અસ્વીકાર.
 - હકીકતાની પારદર્શિતા પ્રદર્શિત કરવી.
 - સંદેશાના સમાવિષ્ટ વિચારોનું એક્ય સાધ્યતુ.

૪. રીતમાવ/શિષ્ટાચાર :

પ્રત્યાયનની એવી રીતિ કે નીતિ છે અને તે મજબુતનું પ્રત્યાયન અસરકારક હોય છે. નીચે દર્શાવેલ લાખણિકાતમો સારી રીતભાત કે શિષ્ટાચારની ગંગાવામાં આવે છે.

૫. પ્રત્યુત્તર જડપથી આપવો.
૬. અન્યને મુશ્કેલીમાં ન મુકે તેવું લખાણ કે વાચન કરવું.
૭. વિચારને અનુમોદન કે સમર્થન કરવું.
૮. પ્રત્યાયન કરતી વખતે યોગ્ય વિધાન વ્યક્ત કરવું.

**૫. ચોકસાઈઃ :**

સાથી અને સર્વસામાન્ય હકીકતોની કે વિચારોની રજૂઆત, યોગ્ય સમયે ઉચિત પ્રતિભાવ, પ્રત્યાયનની શૈલી મુજબનો પ્રતિભાવ અને વયક્ષા, અનુભવોને ધ્યાનમાં લઈને થતું પ્રત્યાયન વગેરે બાબતો દ્વારા તેની ચોકસાઈ જાળવી શકાય છે. ચોકસાઈ જેટલી જળવાય તેટલી પ્રત્યાયન પ્રક્રિયા ચેતનવંતી બને છે.

૬. સંક્ષિપ્તતાઃ :

પ્રત્યાયનમાં જરૂર પૂરતા શબ્દો/વાક્યોનો ઉપયોગ, બિનજરૂરી વર્તનોને ટાળવા, બિનજરૂરી પુનરાવર્તન ટાળવું અને અસ્પષ્ટ અને અસંદિગ્ય અભિવ્યક્તિ એ પ્રત્યાયન માટેની મહત્વની બાબતો ગણાય છે. તેમાં સંક્ષિપ્તતા દ્વારા સચોટતા આવે છે.

૭. વિષયવસ્તુનું જ્ઞાન :

સંદેશાઓને અસરકારક બનાવવા માટે સંદેશા મોકલનાર વ્યક્તિઓ પાસે સંદેશાઓને લગતી બાબતોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે વળી વિષયવસ્તુની સંપૂર્ણ જાણકારી હોય તે જરૂરી છે, જેનાથી વિસ્તૃત માહિતી મોકલી શકાય છે. વિષયવસ્તુના જ્ઞાનથી વાસ્તવિકતા આવે છે.

૮. પ્રત્યુત્તરઃ :

સંદેશો મોકલનાર વ્યક્તિને સંદેશાઓ મોકલ્યા બાદ સંદેશો મેળવનાર વ્યક્તિની પ્રતિક્રિયાઓ, ફરિયાદો, વિચાર વગેરે જાળવાનો જરૂરી પ્રયાસ કરવો જોઈએ. જેથી કરીને યોગ્ય સમજ આપી શકાય અને સામેની વ્યક્તિની ગેરસમજ દૂર થાય. તેમાં પ્રત્યુત્તર પ્રાન્ત થાય છે.

કોઈપણ શાળાના સંચાલક એટલે કે અધ્યક્ષ અને શિક્ષકમાં પ્રત્યાયન કરતી વખતે ઉપરોક્ત સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જરૂરી છે. જેથી કરીને પ્રત્યાયનને સુદૃઢ અને વધારે અસરકારક બનાવી શકાય. પ્રત્યાયન માટે આ બધી જ બાબતો બહુ જ જરૂરી છે.

પ્રત્યાયનનું ચક**ભૂમિકા :**

પ્રત્યાયન એક પ્રાણવાન પ્રક્રિયા છે, જેમાં સંદેશાની શીધત્યા આપ-લે થાય છે. માહિતી એક પાસેથી બીજા પાસે જાય છે. આમ, સંદેશા કે માહિતીની આપ-લે સમજજવા માટે પ્રત્યાયન ચકને જાણવું જરૂરી છે. પ્રત્યાયન એક મનોશારીરિક બાબત છે, જેમાં જીવવિજ્ઞાન અને મનોવિજ્ઞાન બંનેનો સુભગ સમન્વય સધાય છે. તેથી પ્રત્યાયનનું ચક ચાલ્યા કરે છે.

પ્રત્યાયન દૂરસંચાર પ્રણાલીના માધ્યમોમાં રેડિયો સંચાર, ઉપગ્રહસંચાર, પ્રકાશીયતંત્ર સંચાર, ટેલ્યુવિઝન, કોમ્પ્યુટરસંચાર, ટેલિફોન વગેરે ગણાવી શકાય.

પ્રત્યાયનની પ્રક્રિયા/ ઘટકો

પ્રત્યાયનના પાંચ ઘટકો નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે :

૧. સ્ત્રોત
૨. સંદેશો મોકલનાર
૩. સંદેશો
૪. સંદેશાનું સાધન
૫. સંદેશો સ્વીકારનાર

ડેવિડ કે બર્લોને પ્રત્યાયનના ૧૧ ઘટકો દર્શાવ્યા છે, જે આ પ્રમાણે છે :

૧. સ્ત્રોત :

સંદેશો મોકલવા માટેની પ્રેરણા છે. તે વ્યક્તિને સંદેશો મોકલવાનું ઉદ્દીપન દષ્ટિબિન્દુ પૂરું પાડે છે.

૨. સાંકેતિક ભાષા :

પ્રત્યાયનાની પ્રક્રિયામાં કેન્દ્રસ્થાને ભાષા છે. ભાષા એક સંકેત છે. જ્યારે કોઈ સંકેત હવાના માધ્યમ દ્વારા મોકલાય ત્યારે બોલચાલની ભાષાનો અને જ્યારે લેખિત સંકેતોના માધ્યમ દ્વારા મોકલાય છે. ત્યારે ભાષાના લેખિત સ્વરૂપનો ઉપયોગ થાય છે. દરેક ભાષાના સંકેત અલગઅલગ હોય છે. સાંકેતિક ભાષા સૂચક બને છે.

૩. સંદેશ :

સંદેશ એ પ્રત્યાયનનું વિષયવસ્તુ છે. સંદેશ એ વિચાર, વસ્તુ કે માહિતીના સ્વરૂપમાં સુપ્રાપ્ત થાય છે. સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશાનો જે અર્થ કરીને મોકલે છે તે જ અર્થ સંદેશો મેળવનાર વ્યક્તિની પાસે થવો જરૂરી છે, તો જ તે સંદેશાનો અર્થ સાર્થક થાય છે. સંદેશો યથાવત સ્વયં સ્પષ્ટ હોવો જોઈએ.

૪. માધ્યમ :

માધ્યમ એ સંદેશાવ્યવહાર માટેનું અગત્યનું સોપાન છે. તે સંદેશો સુપ્રાપ્ત કરનારને સ્ત્રોત સાથે જોડે છે. સંદેશા વાવહારનો કોઈપણ માધ્યમ દ્વારા સંદેશો પ્રાપ્ત કરનારના માર્ગે સંકેતોની રવાનગી થાય છે. તેમાં માધ્યમ મહત્વનું મનાય છે.

**૫. સાધન:**

સંદેશો મોકલવા માટેના વિવિધ ધર્મો છે. પત્યાયનમાં લોર્ડિંચ કે મૌખિક સાધનો જેવા કે પત્રો, ટેલિફોન, ટેલ્વિજન, રેડિયો, ચિત્ર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સબળ સાધનો વડે સંદેશાનું સંવહન શીખતયા થાય છે.

૬. સંદેશો પ્રાપ્ત કરનાર/સંદેશાની સુપ્રાપણ કરનાર:

સંદેશો મેળવનાર સંદેશાને જીવે છે. તેના સંકેતોને ઓળખીને સંદેશો મેળવે છે. એનું કામ સંદેશાને ગ્રહણ કરવાનું છે. સંદેશો સુલભ કરે છે. તે સંદેશો સ્વીકૃતકાર છે.

૭. ઉચિત અર્થઘટન કરવું:

સંદેશો મેળવનાર વ્યક્તિ સંદેશો મેળવ્યા પછી વિવિધ શબ્દો, ચિત્રો, સંકેતો વગેરેનું અર્થઘટન કરે છે. તેને સમજવા સનિષ્ઠ પ્રયત્ન કરે છે. અહીં સંકેતોને ઓળખવા માટે પ્રયત્ન થાય છે અને વિચારોમાં એનું અર્થઘટન કરવામાં આવે છે. ઉચિત અર્થઘટન કરવામાં આવે છે. તેથી સંદેશાના વહનમાં વિશેપ થતો નથી. ઉચિત અર્થઘટન કરવામાં આવે જે સંદેશો સુલભ થાય છે. અનર્થને નિવારવાનું કાર્ય સંગિન રીતે ઉચિત અર્થઘટનને આભારી છે.

૮. અર્થગ્રહણ:

પત્યાયનમાં મહાત્વનો હેતુ એ છે કે સંદેશો મેળવનાર વ્યક્તિ સંદેશાને એ જ અર્થમાં સમજતો હોવો જોઈએ જે અર્થમાં મોકલનાર વ્યક્તિ સમજે છે. એટલે કે બંનેમાં સંદેશાઓની એકસરખી સમજ સ્પષ્ટ થવી જોઈએ. આ બાબત ત્યારે જ શક્ય બને જયારે બંને વ્યક્તિઓ ભાષા અને સંકેતો અને વિષયવસ્તુથી સુપરિચિત હોય.

૯. પ્રતિચાર:

જ્યારે વિચાર સ્ત્રોત છે, ત્યારે તેનો અભિવ્યક્તિ બાદ મળતો પ્રતિચાર તેનું પ્રતિપોષણ કરે છે. મનોવિજ્ઞાનમાં ઉધીપન અને પ્રતિચારનું સહચર્ય છે. જ્યારે ઉદ્વીપન હોય ત્યારે પ્રતિચાર સહજ છે. પત્યાયનની પ્રક્રિયા પણ ઉદ્વીપન અને પ્રતિચાર સાથે સરખાવી શકાય. ઉભય પક્ષની ઓતપોતે પ્રક્રિયા છે.

૧૦. પ્રતિપોષણ:

પ્રતિપોષણ એ સંદેશ મેળવનાર વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થયેલ પ્રત્યુત્તરના સંદર્ભમાં સંદેશો મોકલનાર વ્યક્તિને આપવાનો ઉત્તર છે. આ ઉત્તર સંકેતો, શબ્દો, ચિત્રો કે પત્રોના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. આથી પુનઃ તેને સમજવાની પ્રક્રિયા ચાહું થાય છે. પ્રતિપોષણ પ્રામાણિકપણે થવું જોઈએ.

૧૧. ગેરસમજ:

પત્યાયનમાં સંદેશાઓની આપ-લે દરમિયાન વિવિધ પ્રકારની ગેરસમજ થવાની સંભાવના છે. સંદેશાઓનું અર્થઘટન ખોટું થાય, સંદેશાના સંકેતો, ચિત્રો સમજવામાં ભૂલ થાય જેને કારણે ગેરસમજ થઈ શકે છે. આ દૂર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. જો જ સચ્ચાઈનો સાક્ષાત્કાર થાય છે.

પત્યાયનના પ્રકારો

પત્યાયનમાં ફક્ત ભાષાનો જ ઉપયોગ થાય છે, તેવું કહી ન શકાય. પત્યાયનના ઉદ્ભબવથી અત્યાર સુધીના વિકાસ પર નજર કરીએ તો પત્યાયન ભાષાથી પર છે. પત્યાયનની પ્રક્રિયામાં ભાષાનો ઉપયોગ ‘શાબ્દિક પત્યાયન’ તરીકે ઓળખાય છે અને તેમાં ભાષાનો ઉપયોગ થતો નથી, તેવાં તમામ પ્રકારનાં પત્યાયનને ‘અશાબ્દિક પત્યાયન’ તરીકે ઓળખાય છે. પત્યાયન મૂળભૂત રીતે માહિતી કે સંદેશાના આપ-લેની પ્રક્રિયા છે. જેથી સંદેશાનું સ્વરૂપ ‘શાબ્દિક’ કે ‘અશાબ્દિક’ પત્યાયનના બે વિભાગમાં વહેંચી શકાય. અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં આ બંને પ્રકારના પત્યાયનનું આગવું મહાત્વ અંકાય છે.

૧. શાબ્દિક પત્યાયન:

જ્યારે પત્યાયનમાં ભાષાનો ઉપયોગ થાય, ત્યારે તે શાબ્દિક પત્યાયન કહેવાય છે. ભાષાનું સ્વરૂપ તેને બે ભાગમાં વિભાજિત કરે છે. વાણી અને લેખન. ભાષા એ એક સંકેત છે, એટલે જ્યારે સંદેશો મોકલનાર અને મેળવનાર બંને સમાન સંકેતોનું જ્ઞાન ધરાવતા હોય ત્યારે જ આ પ્રકારનું પત્યાયન શક્ય બને છે. દા.ત.ગુજરાતી કે અંગ્રેજી જાણકાર બે વ્યક્તિઓ શાબ્દિક પત્યાયન કરી શકે છે, પણ ગુજરાતી અને ઉર્દુ ભાષા જાણકાર બે વ્યક્તિ વાતચીત કરી શકતી નથી. આમ, શાબ્દિક પત્યાયનમાં લેખિત, મૌખિક, દશ્ય અને દશ્ય-શાય સાધનો જેવાં પત્યાયનનો ઉપયોગ થાય છે. શબ્દ દારા સાકાર થાય છે.

૨. અશાબ્દિક પત્યાયન:

સાગરકંડ ઊભી કરેલી એક દીવાદાંસી એક સંકેત છે અને તે ખલાસીને નજીકમાં કિનારો હોવાનો સંદેશો પાઠવે છે યા તો સંકેત, ભયસ્થાન સૂચવે છે. ‘સંકેત’ ભાષાથી પર પત્યાયનની પ્રક્રિયા છે. ચહેરા પર વ્યક્ત થતા શારીરિક હાવ-ભાવ, વ્યક્તિનું હલન ચલન અને વ્યક્તિનું અંખનું મેળવવું પણ સંદેશો સૂચવે છે. તેમાં સંદેશો મોકલનાર સંદેશો જ વ્યક્તિને પહોંચાડવો હોય તાં સુધી પહોંચાડવી શકે છે. આમ, શબ્દના ઉપયોગ વગર થતી પત્યાયનની પ્રક્રિયા ‘અશાબ્દિક પત્યાયન’ છે. આમ, પત્યાયન દારા જરૂરી માહિતી પ્રાપ્ત કરી, શંકાઓ અને ગેરસમજ દૂર કરી પરસ્પરનો સહકાર અને સહયોગ વધારી શકાય છે. માહિતીયુગમાં માહિતીસંચાર પરંપરાગત માધ્યમો પર આધુનિક જીવની વસ્તુ બની ગઈ છે. જેને સંચાર પત્યાયન કહી શકાય.

ઇલ્લા એક દશકમાં માહિતી-તકનિકના સંદર્ભ ભારત પણ વિશ્વનાં અન્ય વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવે છે. અનતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોથી માંનીને ફેક્સ, ઇન્ટરનેટ, ઈ-મેઈલ, ટેલિ-કોન્ફરન્સ, વીડિયો કોન્ફરન્સ અને અન્ય વિજ્ઞાન માધ્યમોનો ઉપયોગ જાણે સાહજિક બનતો જાય છે. આપણા દેશમાં તાર સેવાઓઓ આરંભ ૧૮૮૮ અને ટેલિફોનસેવાનો પ્રારંભ ૧૮૮૮ માં થયો હતો. કમશા: તેમાં સુધારા-વધારા કરી પત્યાયન પ્રોફોગિકી-ટેકનોલોજીનો ઘણો વિકાસ સધાતો ગયો. ૧૯૮૮ માં ટેલિકોમ નીતિમાં બધાને માટે પોથાય તેવી દૂરસંચારની વ્યવહાર-સંગવડો ઊભી કરાઈ. ૧૯૭૦ પછી તો કમ્પ્યુટર, કમ્પ્યુનિકેશન અને કંપ્લોન ઇજનેરીનો વિકાસ નોંધપાત્ર થયો. આ ત્રણોય ક્ષેત્રોમાં પરસ્પર સંબંધ અને જોડાણથી માહિતી, ઉત્પાદન અને સેવાઓનાં ક્ષેત્રોમાં જે બદલાવ આવ્યો તે “માહિતી કાંતિ” ને નામે ઓળખાય છે.

★ संदर्भ ★

१. शाह निरव, शाणा संचालन अने व्यवस्था, अमदावादः निरव प्रकाशन, २००७
२. प्रज्ञापति भणीभाई, २१मी सटीमां ग्रंथालयोनी बदलाती जती भूमिका २००३, अमदावादः पञ्चिकेशन, पाना.
३. गुजराती विश्वकोश
४. शंकरसिंह सुचना प्रोधोगिकी और पुस्तकालय नई दिल्लीः एस एस पब्लिकेशन, २००३
५. त्रिपाठी एस. एम्. और अन्य ग्रंथालय एवं सुचना विज्ञान, नई दिल्लीः एस.एस. प्रकाशन
६. <http://en.wikipedia.org/wiki/Communication>

